https://archive.org/details/bk928/page/n0/mode/1up

2015-05-25 -Nagpur -Umiya Dham -Pran Pratistha Mahotsav (928)

All Items on https://archive.org/details/realpatidar
Full Library on https://realpatidar.com/library

આત્મીય આમંત્રણ

Book-Post

માઁ ઉમિયા ચેરીટેબલ ટ્રસ્ટ નાગપુર આયોજીત

શ્રી ઉમિયા માતાજી મંદિર

ઉમિયાં ધામ

પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ

તા. ૨૫-૫-૨૦૧૫ થી તા. ૨૮-૫-૨૦૧૫

પ્રારંભ
તા. ૨૫-૫-૨૦૧૫
સોમવાર

પૂર્ણાહુતિ
તા. ૨૮-૫-૨૦૧૫
ગુરુવાર



To.

નિમંત્રક

માઁ ઉમિયા ચેરીટેબલ ટ્રસ્ટ
કાપસી (બુ) ભંડારા રોડ, નાગપુર (મહારાષ્ટ્ર)-૪૪૦૦૩૫
Email :-maaumiyadham@gmail.com
:: કાર્યાલય સંપર્ક ::
80070-85215, 98231 69022, 94228 20993, 93706 69158, 91686 38750

realpatidar.com

https://archive.org/details/bk928/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

No specific pages. See whole book.
References by: RealPatidar.com

https://archive.org/details/bk928/page/n2/mode/1up

realpatidar.com

આત્મીય આમંત્રણ

Book-Post

માઁ ઉમિયા ચેરીટેબલ ટ્રસ્ટ નાગપુર આયોજીત

શ્રી ઉમિયા માતાજી મંદિર

ઉમિયાં ધામ

પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ

તા. ૨૫-૫-૨૦૧૫ થી તા. ૨૮-૫-૨૦૧૫

પ્રારંભ
તા. ૨૫-૫-૨૦૧૫
સોમવાર

પૂર્ણાહુતિ
તા. ૨૮-૫-૨૦૧૫
ગુરુવાર



To.

નિમંત્રક

માઁ ઉમિયા ચેરીટેબલ ટ્રસ્ટ
કાપસી (બુ) ભંડારા રોડ, નાગપુર (મહારાષ્ટ્ર)-૪૪૦૦૩૫
Email :-maaumiyadham@gmail.com
:: કાર્યાલય સંપર્ક ::
80070-85215, 98231 69022, 94228 20993, 93706 69158, 91686 38750

realpatidar.com

https://archive.org/details/bk928/page/n3/mode/1up

2015-05-25 -Nagpur -Umiya Dham -Pran Pratistha Mahotsav (928)



https://archive.org/details/bk928/page/n4/mode/1up

realpatidar.com



શ્રી ગણેશાય નમઃ

હાર્દિક નિમંત્રણ



શ્રી લક્ષ્મીનારાયણાય નમઃ

આદરણીય સ્નેહી શ્રી ....

પરમ કૃપાળુ **કુળદેવી શ્રી ઉમિયા માતાજી**ની અસિમ કૃપા તથા અમારા **માતૃશ્રી પાનબાઈમાઁ** ની પ્રબળ પૂણ્યોદય થી નાગપુરની પાવન ભૂમિ પર નવનિર્મિત **"ઉમિયા ધામ"** માં બિરાજમાન **કુળદેવી શ્રી ઉમિયા માતાજી, ઈષ્ટદેવ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ, શ્રી ઉમાપતિ મહાદેવ, શ્રી ગણેશજી, કષ્ટભંજન પવનપુત્ર હનૂમાનજી** તથા **સંત મહાત્માઓ**ની પાવન મૂર્તિઓનો

પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ

સંવત - ૨૦૭૧ જેઠસુદ ૭ ને સોમવાર તા. ૨૫-૫-૨૦૧૫ થી
જેઠ સુદ ૧૦ ને ગુરૂવાર તા. ૨૮-૫-૨૦૧૫

ના રોજ ચતુર્થ દિવસીય મહોત્સવ યજ્ઞાદિ ધાર્મિક દિવ્ય પ્રસંગો સહિત ખૂબ જ ધામધૂમથી ઊજવવાનું નિર્ધારિત કરવામાં આવેલ છે. આ દુર્લભ દિવ્ય મહોત્સવમાં સંતો-મહંતો પધારી આર્શિવચનની અમૃતમય જ્ઞાન ગંગાની સરીતામાં સ્નાન કરાવી ધન્યતાની અનુભૂતિ કરાવશે. આ પાવન ધાર્મિક મહા મહોત્સવને ચિર-સ્મરણીય બનાવવા આનંદના અવસરને આનંદભેર ઊજવવા અને દેવી-શક્તિના દર્શન કરવા તેમજ વિવિધ કાર્યક્રમોને માણવા સાક્ષીરૂપે સહભાગી થવા આ પુનિત મંગલ પ્રસંગે આપશ્રી ને સહકુટુંબ પધારવા સૌને અંતરથી હેતના હિંડોળા સાથે ભાવભર્યુ નિમંત્રણ પાઠવીએ છીએ.

:: નિમંત્રક ::

માઁ ઉમિયા ચેરીટેબલ ટ્રસ્ટ, નાગપુર (મહારાષ્ટ્ર)

શ્રી જીવરાજભાઈ રતનશીભાઈ હળપાણી તેમજ શ્રી દિનેશભાઈ રતનશીભાઈ હળપાણી પરિવાર

(કચ્છમાં મથલ)

:: શુભ સ્થળ ::

"માઁ ઉમિયા ધામ" માઁ ઉમિયા ઔદ્યોગિક સહકારી વસાહત, ભંડારા રોડ, કાપસી (બુ) નાગપુર (મહા.)



realpatidar.com

realpatidar.com

માંગલિક પાવન પ્રસંગો

તા. ૨૫-૫-૨૦૧૫ સોમવાર

સવારે ૭.૦૦ કલાકે	: ઊંઝાથી પગપાળા આવેલ દિવ્ય જ્યોતિ અને પાવન મૂર્તિઓની નગર શોભાયાત્રા "માઁ ઉમિયા" કલમનાથી પ્રસ્થાન
સવારે ૧૦.૩૦ કલાકે	: યજ્ઞ મંડપ પ્રવેશ, સંતશ્રીઓના સામૈયા, ધર્મધજા આરોહણ, યજ્ઞાદિ કાર્યની શુભ શરૂઆત
બપોરે ૧૨.૦૦ કલાકે	: સમૂહ પ્રસાદ ગ્રહણ - વિરામ
બપોરે ૩.૦૦ કલાકે	: સંતશ્રીઓના સાનિધ્યમાં આર્શિવાદ સમારોહ દીપ પ્રાગટ્ય ઉદ્‌ઘાટક : મા. શ્રી પ્રવિણ દટકે (મેયર શ્રી નાગપુર) મુખ્ય અતિથી : મા. શ્રી પ્રફૂલભાઈ પટેલ (સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી) તથા અન્ય આમંત્રિત મહાનુભાવો
સાંજે ૬.૧૫ કલાકે	: સાયં આરતી - થાળ
સાંજે ૭.૦૦ કલાકે	: સમૂહ પ્રસાદ ગ્રહણ
રાત્રે ૮.૦૦ કલાકે	: રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો

તા. ૨૬-૫-૨૦૧૫ મંગળવાર

સવારે ૭.૦૦ કલાકે	: પ્રાતઃ આરતી
સવારે ૭.૩૦ કલાકે	: પ્રધાનદેવો સ્થાપન પૂજન
સવારે ૮.૩૦ કલાકે	: સંતશ્રીઓની અમૃતવાણી
બપોરે ૧૨.૦૦ કલાકે	: સમૂહ પ્રસાદ ગ્રહણ - વિરામ
બપોરે ૩.૦૦ કલાકે	: અતિથીઓના આર્શિવચનો મુખ્ય અતિથી : મા. શ્રીમતી આનંદીબેન પટેલ (મુખ્યમંત્રી શ્રી, ગુજરાત રાજ્ય) વિશેષ અતિથી : મા. શ્રી મોહનભાઇ કુંડારીયા (કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી) તથા ગુજરાત રાજ્યના આમંત્રિત મંત્રીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ
સાંજે ૬.૧૫ કલાકે	: સાયં આરતી - થાળ - યજ્ઞદર્શન
સાંજે ૭.૦૦ કલાકે	: સમૂહ પ્રસાદ - ગ્રહણ
સાંજે ૮.૦૦ કલાકે	: ગુજરાતના પ્રખ્યાત કલાકારો દ્વારા લોક સાહિત્ય સંગીતમય ડાયરો



realpatidar.com

realpatidar.com

માંગલિક પાવન પ્રસંગો

તા. ૨૭-૫-૨૦૧૫ બુધવાર

સવારે ૭.૦૦ કલાકે : પ્રાતઃ આરતી
સવારે ૮.૩૦ કલાકે : સંતશ્રીઓની અમૃતવાણી
બપોરે ૧૨.૦૦ કલાકે: સમૂહ પ્રસાદ ગ્રહણ - વિરામ
બપોરે ૩.૦૦ કલાકે : સંતશ્રીઓના તથા સામાજીક અગ્રણીઓના આર્શિવચનો

મુખ્ય અતિથીઓ :
મા.શ્રી ગંગારામભાઈ સાંખલા (અધ્યક્ષશ્રી, અ.ભા.ક.ક.પા.સમાજ નખત્રાણા)
મા.શ્રી નારાયણભાઈ પટેલ (અધ્યક્ષશ્રી, ઊમિયા માતાજી સંસ્થાન, ઊંઝા)

સાંજે ૫.૦૦ કલાકે : મૂર્તિઓનો મહા અભિષેક
સાંજે ૬.૧૫ કલાકે : સાયં આરતી - થાળ - હવન દર્શન
સાંજે ૭.૦૦ કલાકે : સમૂહ પ્રસાદ ગ્રહણ
સાંજે ૮.૦૦ કલાકે : રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ

તા. ૨૮-૫-૨૦૧૫ ગુરૂવાર

સવારે ૭.૦૦ કલાકે : પ્રાતઃ આરતી
સવારે ૮.૦૦ કલાકે : સ્થાપિત દેવી - દેવતાઓની પૂજા, શોભાયાત્રા, મૂર્તિઓનો મંદિર ગર્ભગૃહ પધરામણી, પ્રાણ - પ્રતિષ્ઠા, શ્રીફળ હોમ
સવારે ૧૨.૩૦ કલાકે: સમૂહ મહાપ્રસાદ ગ્રહણ - વિરામ
બપોરે ૩.૦૦ કલાકે : સમાપન સમારોહ

મુખ્ય અતિથી : મા.શ્રી દેવેન્દ્ર ફડણવીસ - મુખ્યમંત્રી, મહારાષ્ટ્ર રાજ્ય
વિશેષ અતિથી : મા.શ્રી નિતીન ગડકરી - કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી
વિશેષ અતિથી : મા.શ્રી ચંદ્રશેખર બાવનકુલે - ઉર્જા અને પાલક મંત્રી
વિશેષ અતિથી : મા. શ્રી સુધીર મુંનગટ્ટીવાર - નાણા અને વન મંત્રી
અતિથી : મા.શ્રી કૃપાલ તુમાને - સાંસદ,
અતિથી : મા.શ્રી કૃષ્ણા ખોપડે - વિધાયક
તથા અન્ય આમંત્રિત રાજનાયકો

સાંજે ૬.૧૫ કલાકે : મહાઆરતી - થાળ - મંદિર દર્શન
સાંજે ૭.૦૦ કલાકે : સમૂહ પ્રસાદ ગ્રહણ
રાત્રે ૮.૦૦ કલાકે : સંગીતના તાલે મહા રાસગરબાની રમઝટ



realpatidar.com

realpatidar.com

આશીર્વાદ સાથે દર્શન લાભ

પરમ શ્રદ્ધેય આચાર્યશ્રી મહામંડલેશ્વર અનન્તશ્રી વિભુષિત
સ્વામીશ્રી અવધેશાનંદ ગિરીજી મહારાજ (અંબાલા આશ્રમ)
પરમ શ્રદ્ધેય શ્રી નિરંજન પીઠાધિશ્વર આચાર્યશ્રી મહામંડલેશ્વર ૧૦૦૮
સ્વામી પુણ્યાનંદ ગિરીજી મહારાજ
પરમ પૂજ્ય ચિદાનંદ સરસ્વતીજી મહારાજ (મુનિજી)
અધ્યક્ષ : પરમાર્થ આશ્રમ, ઋષિકેશ
પરમ પૂજ્ય ગુરૂવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીજી
અધ્યક્ષ : શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP), અમદાવાદ
પરમ પૂજ્ય વિરકત સંત શિરોમણી સ્વામી
શ્રી ભગવતાનંદ ગિરીજી (હરિઓમ આશ્રમ, બડવાહ)
પરમ પૂજ્ય પરમાત્માનંદજી મહારાજ
મહામંત્રી : હિન્દુ ધર્માચાર્ય સભા, રાજકોટ
પરમ પૂજ્ય સંતશ્રી હરિદાસજી મહારાજ, ગુરૂશ્રી વાલરામજી મહારાજ
શ્રી કચ્છીલાલ રામેશ્વર આશ્રમ, હરિદ્વાર
પરમ પૂજ્ય સ્વામીશ્રી વૃંદાવન વિહારીદાસજી
શ્રી લક્ષ્મીનારાયણ સંસ્કાર ધામ, દેસલપર (કચ્છ)
પરમ પૂજ્ય પા. ગો. ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી (સુરત - વડોદરા)

શુભેચ્છક તથા માર્ગદર્શક

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ, નખત્રાણા
શ્રી કચ્છ પાટીદાર સમાજ, લકડગંજ, નાગપુર
શ્રી પાટીદાર સમાજ, ઘાટ રોડ, નાગપુર
શ્રી ગુજરાતી સમાજ, વર્ધા રોડ, નાગપુર
શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા
શ્રી ઉમિયા માતાજી ઈશ્વરરામજી ટ્રસ્ટ, વાંઢાય
શ્રી અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજ, દેસલપર
શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ, સિંદસર
શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ, નખત્રાણા
શ્રી અખિલ ભારતીય કડવા પાટીદાર મહિલા સંઘ, નખત્રાણા
શ્રી નાગપુર ટિમ્બર મર્ચન્ટ એશોસિએશન, નાગપુર



realpatidar.com

https://archive.org/details/bk928/page/n8/mode/1up

realpatidar.com

શુભેચ્છક તથા વિશેષ અતિથી

મા. શ્રી વિજય દર્ડા	-સાંસદ
મા. શ્રી અજય સંચેતી	-સાંસદ
મા. શ્રી અવિનાશ પાંડે	-સાંસદ
મા. શ્રી વિકાશ કુંભારે	-વિધાયક
મા. શ્રી સુધાકર કોહલે	-વિધાયક
મા. શ્રી ડો. મિલીંદ માને	-વિધાયક
મા. શ્રી સુધાકર દેશમુખ	-વિધાયક
મા. શ્રી સુધીર પારવે	-વિધાયક
મા. શ્રી મલ્લીકાર્જુન રેડ્ડી	-વિધાયક
મા. શ્રી સમીર મેઘે	-વિધાયક
મા. શ્રી આશિષ દેસમુખ	-વિધાયક
મા. શ્રી અનિલ સોલે	-વિધાયક
મા. શ્રી પ્રકાશ ગજભીયે	-વિધાયક
મા. શ્રી રાજેન્દ્ર મુલક	-વિધાયક
મા. શ્રી નાગોજી ગાણાર	-વિધાયક
મા. શ્રી જોગેન્દ્ર કવાડે	-વિધાયક
મા. શ્રી દેવજીભાઇ પટેલ	-વિધાયક છ.ગ.
મા. શ્રી રમેશ શિંગારે	-અધ્યક્ષ સ્થા.સમિતી
મા. શ્રી ચેતનાબેન ટાંક	-નગર સેવિકા
મા. શ્રી નરેન્દ્ર બોરકર	-નગર સેવક

મા. શ્રી પુરુપોત્તમભાઇ રૂપાલા	-રાષ્ટ્રીય ઉપા. ભાજપ
મા. શ્રી નિતીનભાઇ પટેલ	-મંત્રીશ્રી, ગુજરાત
મા. શ્રી સૌરભભાઇ પટેલ	-મંત્રીશ્રી, ગુજરાત
મા. શ્રી રજનીભાઇ પટેલ	-મંત્રીશ્રી, ગુજરાત
મા. શ્રી પ્રદિપસિંહ જાડેજા	-મંત્રીશ્રી, ગુજરાત
મા. શ્રી જયશ્રીબેન પટેલ	-સાંસદ
મા. શ્રી નરોત્તમભાઇ પટેલ	-ધારાસભ્ય
મા. શ્રી અરવિંદભાઇ પટેલ	-ધારાસભ્ય
મા. શ્રી સુરેશભાઇ પટેલ	-ધારાસભ્ય
મા. શ્રી બાબુભાઇ પટેલ	-ધારાસભ્ય
મા. શ્રી રણછોડભાઇ પટેલ	-ધારાસભ્ય
મા. શ્રી હસમુખભાઇ પટેલ	-ધારાસભ્ય
મા. શ્રી જયંતિભાઇ કવાડીયા	-ધારાસભ્ય
મા. શ્રી મહેશભાઇ પટેલ	-ધારાસભ્ય
મા. શ્રી પ્રહલાદભાઇ પટેલ	-ધારાસભ્ય
મા. શ્રી તેજશ્રીબેન પટેલ	-ધારાસભ્ય
મા. શ્રી દિલીપભાઇ પંડ્યા	-ધારાસભ્ય
મા. શ્રી બાવનજીભાઇ મેતલીયા	-ધારાસભ્ય
મા. શ્રી ચીમનભાઇ શાપરીયા	-ધારાસભ્ય
મા. શ્રી અરવિંદભાઇ લાડાણી	-ધારાસભ્ય
મા. શ્રી કાન્તિભાઇ અમૃતિયા	-ધારાસભ્ય
મા. શ્રી અશોકભાઇ પટેલ	-ધારાસભ્ય
મા. શ્રી ઋષિકેશભાઇ પટેલ	-ધારાસભ્ય
મા. શ્રી પ્રવિણભાઇ માકડીયા	-ધારાસભ્ય
મા. શ્રી છબીલદાસ પટેલ	-પૂ. ધારાસભ્ય

વહેલા રે પધારજો.... ! રૂડા નાગપુર ગામ....
આપના આદર્યા પૂર્ણ કરશે.... "માઁ ઉમિયા ધામ"

વિશેષ નોંધ :

૧. મહોત્સવ દરમ્યિાન પધારેલ ભાવિક દર્શનાર્થી ભાઈ-બહેનો તેમજ બાળકો માટે વિવિધ મનોરંજન માટે એમ્યુઝમેન્ટ પાર્ક તથા વ્યાપારી બંધુઓ માટે ટ્રેડ સેન્ટરના અનોખા આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

૨. બહારગામથી પધારનાર ભાવિક ભક્તો માટે આવાસ-નિવાસની સુગમ વ્યવસ્થા કરવામાં આવેલ છે. આગમનની આગોતરી જાણકારી આપવા નમ્ર નિવેદન છે.

સંપર્ક સૂત્ર : 94236 09677, 98226 40166, 98222 36209, 94221 27810



realpatidar.com